

વંચાણો: અત્રેની યુનિવર્સિટીના જાહેરનામાં નં. ૭૮૫/૨૦૨૨, તા. ૧૬/૦૨/૨૦૨૨.

## ૐ પરિપત્ર ૐ

**વિષય:- રીવોલ્વીંગ ફંડ (૮૫૧૦-એન)ના આવક/ નફા માંથી હાથ ધરવાના થતાં વર્ગીકૃત પ્રકારના કામો, ફાર્મ મશીનરી, અન્ય સાધનોની ખરીદી તથા ડેવલોપમેન્ટના કામોનાં ખર્ચ માટે નિતિ નક્કી કરવા બાબત...**

આથી સંબંધકર્તા સર્વેને જણાવવાનું કે, હાલ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા રીવોલ્વીંગ ફંડના આવક/ નફા માંથી કરવામાં આવતા વર્ગીકૃત પ્રકારના કામો તથા ફાર્મ મશીનરીની ખરીદી માટે તેમજ અન્ય ડેવલોપમેન્ટના કામોની ખરીદી/ ખર્ચ માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટી, નિયામકશ્રી, ખરીદ અને મિલકતની કચેરી, સરદાર કૃષિનગર-૩૮૫ ૫૦૬નાં જાહેરનામાં ક્રમાંક: જ.નં. ગુફ્યુ/ડીપીપી/પીબી-૧/૮૩૦૬-૪૫ તા.૧૮/૦૧/૨૦૦૧ તેમજ જ.નં. ગુફ્યુ/ડીપીપી/ ઈ.ક/૨૬૧૪-૩૫/૨૦૦૩ તા.૨૭/૦૮/૨૦૦૩ થી નક્કી કરવામાં આવેલ નિતિ નિયમો પ્રમાણે ખરીદી/ ખર્ચ કરવામાં આવે છે. જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિ, સમય અને સંબંધોને ધ્યાને લઈ યુનિવર્સિટીના વિવિધ કાર્યક્ષેત્ર શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ શિક્ષણની પ્રવૃત્તિઓને વેગ આપવા તેમજ વ્યવસ્થાપન અને હેતુઓને સિદ્ધ કરવા અર્થે સદર નિતિ નિયમોમાં સંશોધન કરી સુધારા-વધારા કરવામાં આવેલ છે. જે અન્વયે નીચે મુજબના (અ) અને (બ)ની વિગતે રીવોલ્વીંગ ફંડ (૮૫૧૦-એન)ના આવક/ નફા માંથી હાથ ધરવાના થતાં વર્ગીકૃત પ્રકારના કામો, ફાર્મ મશીનરી, અન્ય સાધનોની ખરીદી તથા ડેવલોપમેન્ટના કામોનાં ખર્ચ માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની નાણાં સમિતિની ૨૦મી બેઠકની કાર્યવાહી નોંધના મુદ્દા નં. ૨૦.૮ થી થયેલ ભલામણ મુજબ તેમજ સંચાલક મંડળની ૪૬મી બેઠકની કાર્યવાહી નોંધના મુદ્દા નં. ૪૬.૨૫ થી મંજૂરી મળેલ છે (જાહેરનામાં નં. ૭૮૫/૨૦૨૨).

**(અ) આવક/ નફા માંથી હાથ ધરવાના થતાં વર્ગીકૃત પ્રકારના કામો, ફાર્મ મશીનરી, અન્ય સાધનોની ખરીદી તથા ડેવલોપમેન્ટના કામો:**

૧. આબોહવા અનુસાર પાકતા પાકો અથવા તો તાંત્રિક રીતે યોગ્ય લાગે તેવા પાકો અને ફળાકાંડના રોપાઓ તૈયાર કરવા સારું કન્ટીજન્સી ખર્ચ.
૨. વિવિધ કક્ષાના બીજ ઉત્પાદન કાર્યક્રમ, કલમો, રોપાઓના કાર્યક્રમ, ફેરબદલીના પાકોના હેતુસર.
૩. બાગાયતી પાકોની રોપાઓ કલમો તૈયાર કરવી તથા ખેડૂતોને પુરી પાડવા વેચાણનું આયોજન કરવાના હેતુસર.
૪. બેકરી ઉત્પાદન, ફીશરીઝ ઉત્પાદન, ખેત ઓખરોનું ઉત્પાદન/ રીપેરીંગ, પોલ્ટ્રી ઉત્પાદન, ડેરી ઉત્પાદન જેવી પ્રવૃત્તિઓના હેતુસર.
૫. ખેત ઉત્પાદન વધારવા સહાયભૂત થાય તેવું બાંધકામ કે સંગ્રહ કરવા જરૂરીયાત હોય તેવા બાંધકામના હેતુસર.



**Please consider your environmental responsibility. Before printing this circular message, ask yourself whether you really need a hard copy.**

૬. ટ્રેશિંગ ચાર્જની કામગીરી.
૭. ગોડાઉન/ સ્ટોર રૂમ/ વહીવટી મકાન બાંધકામ.
૮. બુલોક શેડ.
૯. ઇમ્પ્લીમેન્ટ શેડ/પાર્કિંગ શેડ .
૧૦. પંપ હાઉસ.
૧૧. કુવા ઉંડા કરવા/ રીચાર્જ કરવા.
૧૨. પાકા ઢાળિયા બનાવવા.
૧૩. પાઇપ લાઇન નાખવી.
૧૪. હાર્મ/ કેમ્પસના રસ્તા બનાવવા તથા સમારકામ કરાવવું.
૧૫. હાર્મ/ કેમ્પસની દિવાલ/ કમ્પાઉન્ડ વોલ.
૧૬. વાયર ફેન્સિંગ/ ચેઇન લિંક.
૧૭. કુવા/ ટ્યૂબવેલ બનાવવા.
૧૮. સબમર્સિબલ પંપ ખરીદવા.
૧૯. ટ્રેક્ટર ખરીદી/ ટ્રેઇલર ખરીદી તેમજ તેને સંલગ્ન સાધનો.
૨૦. ઇલેક્ટ્રીક મોટર/ ઓઇલ એન્જીન/પંપ ખરીદી માટે.
૨૧. ખેત તલાવડી/ પાકી ખેત તલાવડી (Paki Khet Talavadi).
૨૨. સાયલો પીટ.
૨૩. તમામ ઇરીગેશન સિસ્ટમ.
૨૪. ગ્રીન હાઉસ/ પોલી હાઉસ.
૨૫. બિન ખેડાણ વિસ્તારને ખેડાણ હેઠળ લાવવા માટે ઇલેક્ટ્રીક કનેક્શન માટે વીજ કનેક્શન ચાર્જ.
૨૬. જમીન સુધારણા/ જમીન સમતલ.
૨૭. પિયત સુવિધા વધારવા/ ઘનિષ્ઠ બનાવવા.
૨૮. જ્યાં ખારા પાણી હોય તેવી જગ્યાએ સમ્પવેલ કરવા.
૨૯. ઉત્પાદનને સહાયરૂપ થાય તેવું ઓફિસ ફર્નિચર.
૩૦. બ્રીડર સીડનું વાવેતર.
૩૧. હાર્મ ઇમ્પ્લીમેન્ટ, ઇક્યુપમેન્ટ એન્ડ એસેસરીઝ.
૩૨. સીડ અને ફુડ પ્રોસેસિંગ ઇક્યુપમેન્ટ.
૩૩. હાર્મ/ હાર્મ ઓફીસના ડેવલોપમેન્ટ/ આધુનિકરણ માટે જરૂરી આઈ.ટી. સાધનો/ સોફ્ટવેર.
૩૪. વહીવટી વિભાગો, વિદ્યા શાખાઓ(કોલેજો) તેમજ વિસ્તરણ કેન્દ્રો યુનિટના હેતુઓ સિદ્ધ કરવા જરૂરી રીકરીંગ, નોન-રીકરીંગ અને કોઈપણ પ્રકારના બાંધકામના કામો (**હકત ખાસ કિસ્સામાં સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી જરૂરી રહેશે**).
૩૫. કેમ્પસ વસાહત ખાતેના જૂના મકાનો રીપેર કરાવવા (રીવોલ્વીંગ હંડના નહાની ૨૫% રકમ).
૩૬. કૃષિ યુનિવર્સિટીમાં નવા વાહનોની ખરીદી.
૩૭. સોલાર પાવર સિસ્ટમ (Solar Power System).
૩૮. માઇક્રો ઇરીગેશન સિસ્ટમ (Micro Irrigation System).
૩૯. ઇંધણ/ વિજળી ખર્ચ.
૪૦. હાર્મ/ કેમ્પસના રસ્તા તેમજ મકાનોની આજુબાજુ નવી ઇલેક્ટ્રીક/સોલાર લાઇટ લગાવવા તેમજ તેના રીપેરીંગ કરાવવા.
૪૧. પ્રિસિઝન ફાર્મિંગ (Precision Farming) માટેના સાધનો.



ઉક્ત (અ) મુજબની કામગીરીઓ માટે થનાર ખર્ચ, જે તે કેન્દ્રોએ પોતાના રીવોલ્વીંગ ફંડમાં જમાં થયેલ આવક/ નફા માંથી જ કરવાનો રહેશે પણ જે કોઈ ખાસ કિસ્સામાં ઉપરોક્ત (અ) મુજબની કામગીરીઓ માટે થનાર ખર્ચ જે તે કેન્દ્ર ઉપર થયેલ આવક/ નફા માંથી કરવાના બદલે યુનિવર્સિટીના અન્ય કેન્દ્રો ઉપર રીવોલ્વીંગ ફંડમાં થયેલ આવક/ નફા માંથી કરવાનો થતો હોય તો જે તે કેન્દ્રના વડાશ્રીઓની અરસ-પરસ સહમતીની દરખાસ્ત/ નોંધ ઉપર હિસાબ નિયામકશ્રી અને સંશોધન નિયામકશ્રીની ભલામણ મેળવી માન.કુલપતિશ્રીની મંજૂરી મેળવવાની રહેશે. રીવોલ્વીંગ ફંડના આવક/ નફા માંથી હાથ ધારવાના થતાં વર્ગીકૃત પ્રકારના કામો તથા હાર્મ મશીનરીની ખરીદી તેમજ અન્ય ડેવલોપમેન્ટના કામોની ખરીદી/ ખર્ચ રટેર્યુટરી જોગવાઈ મુજબ સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી નિયમોનુસાર કરવાનો રહેશે. આ સાથે અખતરા લેવા માટે જે જમીનનો ઉપયોગ થાય છે તે સિવાયની સઘળી જમીનને વાવેતર હેઠળ આવરી લઈ સઘન પ્રયત્નો દ્વારા વધુમાં વધુ ઉત્પાદન મળે અને વધુમાં વધુ આવક ઊભી થાય તેવા ઘનિષ્ઠ પ્રયત્નો કરવાના રહેશે. રીવોલ્વીંગ ફંડ (૯૫૧૦-એન)ના આવક/ નફા માંથી હાથ ધરવાના થતાં વર્ગીકૃત પ્રકારના કામો તથા હાર્મ મશીનરીની ખરીદી તેમજ અન્ય ડેવલોપમેન્ટના કામોની ખરીદી/ ખર્ચ માટે આથી નક્કી કરેલ નિતિ નિયમો સિવાયની રીવોલ્વીંગ ફંડની અન્ય નિતિ નિયમો યથાવત રહેશે.

**(બ) રીવોલ્વીંગ ફંડના વ્યાજની આવક માંથી કરવાના થતા કામો:**

રીવોલ્વીંગ ફંડના વ્યાજની આવક માંથી યુનિવર્સિટીના વિવિધ કાર્યક્ષેત્ર શિક્ષણ, સંશોધન, વિસ્તરણ શિક્ષણ અને વહીવટી પ્રવૃત્તિઓને વેગ આપવા તેમજ વ્યવસ્થાપન અને હેતુઓને સિદ્ધ કરવા અર્થે કરવાના થતા ડેવલોપમેન્ટના કામો અને હિસાબ નિયામકશ્રીની કચેરી ખાતે નાણાંકીય વ્યવહારોના વ્યવસ્થાપન, રેકોર્ડની જાણવણીની વ્યવસ્થા તેમજ અન્ય ઓફીસ કામગીરી વ્યવસ્થિત થઈ શકે તે માટે કોઈપણ પ્રકારના રીકર્ડીંગ, નોન-રીકર્ડીંગ અને નવા/ રીપેરીંગ/ રીનોવેશન બાંધકામ/ હર્નિચરના કામો કરાવવા માટે તેમજ ખાસ કિસ્સામાં વાહન ખરીદવા હિસાબ નિયામકશ્રી અને સંશોધન નિયામકશ્રીની ભલામણ સહ માન.કુલપતિશ્રીની મંજૂરી મેળવી નિતિ નિયમો મુજબ ખરીદી/ ખર્ચ કરી શકાશે.

ખ.નં. નક્યુ/હિનિ/વવહિઅ/બી-૭-૧ /૧૧૬૦/૨૦૨૨  
નવસારી, તા. ૧૬/૦૨/૨૦૨૨

  
હિસાબ નિયામક

**નકલ સવિનય રવાના:-**

- (૧) અત્રેની યુનિવર્સિટીના તમામ યુનિટ /સબ યુનિટ તરફ જાણ થવા સારૂ.
- (૨) અત્રેની યુનિવર્સિટીના તમામ ઉપાડ અને ચૂકવણાં અધિકારીશ્રીઓ તરફ જાણ થવા સારૂ.
- (૩) વહીવટી-વ-હિસાબી અધિકારી, ન.કૃ.યુ., નવસારી તરફ જાણ તથા ઘટતું થવા સારૂ.

